

માતા-પિતાના  
નામને શોભાવે તેવું,  
આપણું જીવન  
સંસ્કારસંપન્ન  
બનાવીએ તો  
તેઓનું ઋણ  
ચત્કિંચિત  
અદા કર્યું કહેવાય.



આપણા શિક્ષક,  
પ્રાધ્યાપક, ધર્મગુરુ નો,  
આપણા પરના  
ઉપકારનો  
સ્વીકાર કરવો,  
વારંવાર કૃતજ્ઞતા  
પ્રગટ કરતાં રહેવું,  
એનો ઋણસ્વીકાર  
કરવો જરૂરી છે.





તું જેવી રીતે  
ઉત્સાહથી  
સિંહની પેઠે  
(દીક્ષા) લે છે  
તેવી જ રીતે  
પાળવામાં પણ  
ઉત્સાહ રાખજે,  
પ્રમાદ કરીશ નહીં.



બીજા કોઈ  
મુશ્કેલીમાં હોય  
ત્યારે તમે ય  
(કોઈ આશા વિના)  
મદદ કરજો.  
આમ પણ  
ઋણમુક્તિ  
થતી હોય છે.  
એ ઉત્તમ પ્રકાર છે.



આપણે પણ  
કોઈને ટેકારૂપ  
બનીએ તો,  
શુભના એક  
વર્તુળમાંથી  
બીજું વર્તુળ રચાશે,  
વિસ્તરતું રહેશે.



કૃતજ્ઞતા તો  
ગુણોનું  
ભાજન છે.  
ગુણ તેમાં  
રહે છે,  
ટકે છે અને  
શોભે છે.

